

EFC (I) Limited

(Formerly known as Amani Trading and Exports Limited)

Regd. Office Add.: 32, Milan Park Society, Near Jawahar Chowk, Maninagar, Ahmedabad 380008

Corp. Office Add.: Unit No. 1, 2, 3 and 4, 6th Floor, VB Capitol, S No. 209(P), CTS Pune 411007

CIN: L74110GJ1984PLC020026

Tel. No. 020 3502 0912 Email Id: compliance@efclimited.in Website: www.efclimited.in

November 14, 2022

To

BSE Limited

Phiroze Jeejeebhoy Towers,

Dalal Street, Mumbai- 400 001

Scrip Code: 512008

Sub.: Submission of Newspaper publication for Financial Results of Quarter and Half-year ended 30th September, 2022 in compliance of regulation 47 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Dear Sir/Ma'am,

Pursuant to Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed copy of newspaper advertisement with regards to the Financial Results of Quarter and Half-year ended 30th September, 2022 published in the newspaper namely Financial Express and Lokmitra.

Kindly take the same on records.

Thanking You,

For EFC (I) Limited

(formerly known as Amani Trading and Exports Limited)

Umesh Kumar Sahay

Managing Director

DIN: 01733060



indianexpress.com

The Indian Express
— JOURNALISM OF COURAGE —

arrive at a conclusion not an assumption.

inform your opinion with detailed analysis.

The Indian Express.
For the Indian Intelligent.



सेंट्रल बँक ऑफ इंडिया
CENTRAL BANK OF INDIA

Navsari Main Branch : Tower Road, Navsari.

POSSESSION NOTICE
RULE 8 (1) (For Immovable Property)

THE SECURITY INTEREST ENFORCEMENT RULES 2002

Whereas, The Undersigned being the Authorized Officer of the Central Bank of India, Navsari Main Branch, Navsari under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13(12), 13(2) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 30.07.2022 under section 13 (2) of the said act calling upon Mr. Bhopendra Pratsinh Ranvijaysinh Rajput (Borrower), Mr. Yuvrajbhai Sukhabhai Mali (Guarantor) to repay the amount mentioned in the notice being Rs. 9,20,073/- (Rupees Nine Lakh Twenty Thousand Seventy Three Only) as on 30.07.2022 along with interest due thereon within 60 days from the date of receipt of the said notice.

The Borrower / Guarantor having failed to repay the amount, notice is hereby given to the Borrower / Guarantor and public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him under section 13(4) of the said Act read with rule 8 of the said rules on this 8th day of November, of the year 2022.

The Borrowers / Secured Debtors / Guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Central Bank of India, Navsari Main Branch, Navsari for an amount of Rs. 9,20,073/- (Rupees Nine Lakh Twenty Thousand Seventy Three Only) and interest thereon w.e.f. 30.07.2021 plus other charges. (Amount deposited after issuing of demand notice U/Section 13(2) has given effect)

The Borrower's attention is invited to the provision of sub-section (8) of the section 13 of the SARFAESI Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF IMMOVABLE PROPERTY

Property Bearing Revenue Survey No. 119/2 Paiki, Plot No. 86/A, Non-Agriculture Land Adm 400.00 Sq. Ft. situated at Ward No. 12, Ram Nagar, Vijalpora, Tal. Jalalpora, Dist. Navsari, Owned by Mr. Bhopendra Pratsinh Ranvijaysinh Rajput. Bounded By :- East : Plot No. 86, West : Plot No. 87, North : Plot No. 95, South : Road. Date : 08.11.2022. Place : Navsari. Authorised Officer, Central Bank of India

केनरा बँक
Canara Bank

Canara Bank (E-Syndicate Bank), Parle Point Branch, Surat

POSSESSION NOTICE
Appendix -10 (Section 13(4) (for Immovable Property)

Whereas, The undersigned being the authorized officer of the Canara Bank, Parle Point Branch, Surat under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 (Act 54 of 2002) there in after referred to as "the Act" and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a demand notice dated 30.08.2022 under section 13(2) of the said act calling upon the Neetu G Bhargav (Borrower), Ganesh Laxman Bhargav (Borrower), Sumeet Omkar Bhargav (Guarantor) to repay the amount mentioned in the notice being Rs. 12,37,649.36 (Rupees Twelve Lakh Thirty Seven Thousand Six Hundred and Forty Nine and Paise Thirty Six Only) as on 29.08.2022 within 60 days from the date of receipt " of the said notice with future interest and incidental charges w.e.f. 29.08.2022.

The Borrowers and guarantor having failed to repay the amount, notice is hereby given to the Borrowers and guarantor and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of Section 13 of Act read with rule 8 & 9 of the security interest Enforcement Rules 2002 on this 11th day of November of the year 2022.

The Borrowers / Guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Canara Bank, Parle Point Branch, Surat for an amount of Rs. 12,37,649.36 (Rupees Twelve Lakh Thirty Seven Thousand Six Hundred and Forty Nine and Paise Thirty-Six Only) as on 29.08.2022 with future interest and incidental charges w.e.f. 29.08.2022.

The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets."

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

Flat No. 101 & 103, Total Admeasuring About 133.22 Square Meters (Flat No. 101, adm About 66.61 Square Meters) situated on 1st Floor of Building No. C of Param Residency " Village - Laskana, Sub Dist - Kamraj, Dist. Surat. Bounded by :- East : Land of Block No. 104, West : Public Road, North : Surat Kamraj Main Road, South : Land of Block No. A/6. (Name of The Title Holder) Neetu G Bhargav Bhargav & Ganesh Laxman Bhargav. Sd/- Date : 11.11.2022. Place : Surat. Authorised Officer, Canara Bank

सेंट्रल बँक ऑफ इंडिया
CENTRAL BANK OF INDIA

Navsari Main Branch : Tower Road, Navsari.

POSSESSION NOTICE
RULE 8 (1) (For Immovable Property)

THE SECURITY INTEREST ENFORCEMENT RULES 2002

Whereas, The Undersigned being the Authorized Officer of the Central Bank of India, Navsari Main Branch, Navsari under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13(12), 13(2) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 02.05.2022 calling upon the Borrower Mrs. Kalpana Jignesh Solanki (Borrower), Mr. Jigneshbhai Arvindbhai Solanki (Co-Borrower) & Mr. Chunawala Chandrakantbhai V (Guarantor) to repay the amount mentioned in the notice being Rs. 7,88,631/- (In Words : Rs. Seven Lakh Eighty Eight Thousand Six Hundred Thirty One Only) as on 02.05.2022 along with interest due thereon within 60 days from the date of receipt of the said notice.

The Borrower / Guarantor having failed to repay the amount, notice is hereby given to the Borrower / Guarantor and public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him under section 13(4) of the said (Act) read with rule 8 & 9 of the said rules on this 8th day of November, of the year 2022.

The Borrowers / Guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Central Bank of India, Navsari Main Branch, Navsari for an amount of Rs. 7,88,631/- (In Words : Rs. Seven Lakh Eighty Eight Thousand Six Hundred Thirty One Only) and interest & Other Charges thereon with effect from 02.05.2022 (Amount deposited after issuing of demand notice U/Section 13(2) has given effect)

The Borrower's attention is invited to the provision of sub-section (8) of the section 13 of the SARFAESI Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF IMMOVABLE PROPERTY

Property bearing Viraval Revenue Survey No. 187, Non Agriculture land admeasuring 8296.00 sq. meters paiki Plot No. 34 (A-Type), Adm. 38.80 sq. meters + R.S. No. 187/1 (P) Common Plot Adm. 14.22 sq. meters + R.S. No. 187/2 (P) Internal Road, Admeasuring 48.80 sq. meters + R.S. No. 187/3 (P) Open Land Admeasuring 77.10 sq. meters - Total admeasuring 178.92 sq. meters situated at Mithila Nagar, Viraval, Tal. & Dist. Navsari, Owned by : Mrs. Kalpana Jignesh Solanki & Mr. Jigneshbhai Arvindbhai Solanki. Bounded by :- East : Road and Common Plot, West : Plot No. 22, S. No. 187, North : Adjoining S. No. 188/1 P Land, South : Plot No. 33, S. No. 187. Date : 08.11.2022. Place : Navsari. Authorised Officer, Central Bank of India

EFC (I) LIMITED
(formerly known as Amani Trading and Exports Limited
Regd. Off.: 32, Milan Park Society, Near Jawahar Chowk, Maninagar, Ahmedabad-380008
Corp. Off.: Unit No. 1, 2, 3 and 4, 8th Floor, VB Capitol, S.No. 209(P), CTS Pune-411007 CIN: L74110GJ1984PLC020026

EXTRACT OF CONSOLIDATED UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED AS ON 30TH SEPTEMBER, 2022 (Rs. In Lakhs)

Sl. No.	Particulars	Quarter ended		
		30.09.2022 (Un-audited)	30.09.2021 (Un-audited)	30.09.2022 (Un-audited)
1	Total Income from Operations	1,459.60	-	1,499.60
2	Net Profit/(Loss) for the period (before tax, exceptional and/or Extraordinary items)	174.09	0.21	206.92
3	Net Profit/(Loss) for the period before tax (after exceptional and/or Extraordinary items)	174.09	0.21	206.92
4	Net Profit/(Loss) for the period after tax (after exceptional and/or Extraordinary items)	114.79	0.05	140.57
5	Total Comprehensive income for the period [Comprising profit/(loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	114.79	0.05	140.57
6	Equity share capital (of Rs.10/- each)	612.97	69.97	612.97
7	Reserves (excluding revaluation reserve) as shown in the Audited Balance Sheet of the Previous Year	-	94.80	-
8	Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) Basic & diluted	1.87	0.01	2.29

Key Number of Standalone Financial Results

Sl. No.	Particulars	Quarter ended		
		30.09.2022 (Un-audited)	30.09.2021 (Un-audited)	30.09.2022 (Un-audited)
1	Total Income from Operations	375.42	-	415.42
2	Net Profit/(Loss) for the period before tax	116.72	0.21	151.55
3	Net Profit/(Loss) for the period after tax	86.37	0.05	112.15

Notes:
1. The above is an extract of the detailed format of Un-audited Consolidated Financial Results for the quarter ended on September 30, 2022 filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing and other Disclosure Requirements) Regulations, 2015. The full format of the said Financial Results are available on the websites of the Stock Exchange(s) and the company at www.bseindia.com and www.efclimited.in
2. The above financial results of the Company are reviewed and recommended by the Audit Committee and have been approved by the Board of Directors at their respective meetings held on November 12, 2022. The Statutory Auditors have carried out a limited review of these financial results.
For EFC (I) Limited
Sd/-
Umesh Kumar Sahay
Managing Director
(DIN: 01733060)

Place: Pune
Date : November 12, 2022

इंडियन बँक
Indian Bank

Salabatpura (Nanpura Branch), Salabatpura, Shop No. 4, Trade House, Ground Floor, Ring Road, Surat.

POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY)

Whereas, The undersigned being the authorized officer of Indian Bank under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred to him under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 03/06/2022 calling upon the borrower/guarantor Mrs. Purviben Krunalkumar Solanki (Borrower and Mortgagee) and Mr. Krunalkumar Hasmkukhlal Solanki (Co-Borrower) to repay the amount mentioned in the notice being Rs.41,66,772/- (Rupees Forty One Lakhs Sixty Six Thousand Seven Hundred Seventy Two Only) within 60 days from the date of receipt of the said notice.

The Borrower/Guarantor having failed to repay the amount, notice is hereby given to the borrowers and the guarantors and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of the powers conferred on him under section 13(4) of the said Act read with rule 8 of the said rules on 07th day of November, 2022.

The borrowers/guarantors in particular and the public in general are hereby cautioned not to deal with the properties and any dealings with the properties will be subject to the charge of Indian Bank, (E-Alb) Salabatpura Branch, Surat for an amount Rs.41,66,772/- (Rupees Forty One Lakhs Sixty Six Thousand Seven Hundred Seventy Two Only) as on 03/06/2022 and future interest & expenses thereon.

The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of the time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that piece and parcel of the Land Bearing Plot No. 121, Admeasuring 62.50 Sq Mtrs, i.e. 52.55 Sq. Yard, Along with Ground Floor and First Floor Construction in "Shiv Om Nagar Society", Situated on the Land Bearing Survey No. 251 Paiki, T.P S. No. 14 (Rander- Adajan), F.P. No. 101, Block No. 10 of Village: Rander, Sub Dist: Surat City, Dist: Surat. Boundaries : North: 7.5 Mt. Wide Road, South : Adj. Plot No. 130, East : Adj. Plot No. 122, West : Adj. Plot No. 120. Date: 07/11/2022. Authorised Officer, Indian Bank, Salabatpura (E-Alb- Nanpura), Surat.

इंडियन बँक
Indian Bank

Salabatpura (Nanpura Branch), Salabatpura, Shop No. 4, Trade House, Ground Floor, Ring Road, Surat.

POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY)

Whereas, The undersigned being the authorized officer of Indian Bank, (E-Alb) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred to him under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 04/06/2022 calling upon the borrower/guarantor M/s V. R. Syntex Private Ltd., Mr. Vijay Kanubhai Bhagat and Mrs. Sangitaben Vijay Bhagat to repay the amount mentioned in the notice being Rs.4,15,82,251/- (Rupees Four Crores Fifteen Lakh Eighty Two Thousand Two Hundred Fifty One Only) as on 04/06/2022 + further interest and other expenses within 60 days from the date of receipt of the said notice.

The Borrower/Guarantor having failed to repay the amount, notice is hereby given to the borrowers and the guarantors and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of the powers conferred on him under section 13(4) of the said Act read with rule 8 of the said rules on 09th day of November, 2022.

The borrowers/guarantors in particular and the public in general are hereby cautioned not to deal with the properties and any dealings with the properties will be subject to the charge of Indian Bank, (E-Alb) Salabatpura Branch, Surat for an amount Rs.4,15,82,251/- (Rupees Four Crores Fifteen Lakh Eighty Two Thousand Two Hundred Fifty One Only) as on 04/06/2022 + future interest & expenses thereon.

The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of the time available, to redeem the secured assets.

- DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY**
- (1) All That Piece And Parcel Of The Immovable Property Bearing Plot No 95/C, adm 131.68 SQ. Mtrs Together with undivided share adm 98.02 Sq.mtrs in Road & C.O.P in "Gokulam Twin Bungalows", situated on the land bearing Revenue Survey No. 516, Block No. 864, Khata No. 1604, Total Adm 78206 Sq. Mtrs. Paiki 72106 Sq. Mtrs. (after road alignment adm. 6100 Sq.mtrs.) of Village : Mota, Taluka : Bardoli, Dist : Surat. Boundaries : East: Society Road, North: Plot No. 94/C, West: Plot No. 107/C, South: Plot No. 96/A.
 - (2) All That Piece And Parcel Of The Immovable Property Bearing Plot No 96/C, adm 131.68 SQ. Mtrs Together with undivided share adm 98.02 Sq.mtrs in Road & C.O.P in "Gokulam Twin Bungalows", situated on the land bearing Revenue Survey No. 516, Block No. 864, Khata No. 1604, Total Adm 78206 Sq. Mtrs. Paiki 72106 Sq. Mtrs. (after road alignment adm. 6100 Sq.mtrs.) of Village : Mota, Taluka : Bardoli, Dist : Surat. Boundaries : East: Society Road, North: Plot No. 95/C, West: Plot No. 106/C, South: Plot No. 97/A.
 - (3) All That Piece And Parcel Of The Immovable Property Bearing Plot No 98/C, adm 131.68 SQ. Mtrs Together with undivided share adm 98.02 Sq.mtrs in Road & C.O.P in "Gokulam Twin Bungalows", situated on the land bearing Revenue Survey No. 516, Block No. 864, Khata No. 1604, Total Adm 78206 Sq. Mtrs. Paiki 72106 Sq. Mtrs. (after road alignment adm. 6100 Sq.mtrs.) of Village : Mota, Taluka : Bardoli, Dist : Surat. Boundaries : East: Adj. Society's Road, North: Plot No. 97/C, West: Plot No. 104/C, South: Plot No. 99/A.
 - (4) All That Piece And Parcel Of The Immovable Property Bearing Plot No 103/C, adm 131.68 SQ. Mtrs Together with undivided share adm 98.02 Sq.mtrs in Road & C.O.P in "Gokulam Twin Bungalows", situated on the land bearing Revenue Survey No. 516, Block No. 864, Khata No. 1604, Total Adm 78206 Sq. Mtrs. Paiki 72106 Sq. Mtrs. (after road alignment adm. 6100 Sq.mtrs.) of Village : Mota, Taluka : Bardoli, Dist : Surat. Boundaries : East: Plot No. 99/C North: Plot No. 104/C, West: Adj. Society's Road, South: Plot No. 102/A.
 - (5) All That Piece And Parcel Of The Immovable Property Bearing Plot No 104/C, adm 131.68 SQ. Mtrs Together with undivided share adm 98.02 Sq.mtrs in Road & C.O.P in "Gokulam Twin Bungalows", situated on the land bearing Revenue Survey No. 516, Block No. 864, Khata No. 1604, Total Adm 78206 Sq. Mtrs. Paiki 72106 Sq. Mtrs. (after road alignment adm. 6100 Sq.mtrs.) of Village : Mota, Taluka : Bardoli, Dist : Surat. Boundaries : East: Plot No. 97/C North : Plot No. 106/C, West: Adj. Society's Road, South : Plot No. 104/C.
 - (6) All That Piece And Parcel Of The Immovable Property Bearing Plot No 105/C, adm 131.68 SQ. Mtrs Together with undivided share adm 98.02 Sq.mtrs in Road & C.O.P in "Gokulam Twin Bungalows", situated on the land bearing Revenue Survey No. 516, Block No. 864, Khata No. 1604, Total Adm 78206 Sq. Mtrs. Paiki 72106 Sq. Mtrs. (after road alignment adm. 6100 Sq.mtrs.) of Village : Mota, Taluka : Bardoli, Dist : Surat. Boundaries : East: Plot No. 97/C North : Plot No. 105/C, West: Adj. Society's Road, South: Plot No. 103/C.
 - (7) All That Piece And Parcel Of The Immovable Property Bearing Plot No 106/C, adm 131.68 SQ. Mtrs Together with undivided share adm 98.02 Sq.mtrs in Road & C.O.P in "Gokulam Twin Bungalows", situated on the land bearing Revenue Survey No. 516, Block No. 864, Khata No. 1604, Total Adm 78206 Sq. Mtrs. Paiki 72106 Sq. Mtrs. (after road alignment adm. 6100 Sq.mtrs.) of Village : Mota, Taluka : Bardoli, Dist : Surat. Boundaries : East: Plot No. 96/C North : Plot No. 107/C, West: Adj. Society's Road, South : Plot No. 105/C.
 - (8) All That Piece And Parcel Of The Immovable Property Bearing Plot No 107/C, adm 131.68 SQ. Mtrs Together with undivided share adm 98.02 Sq.mtrs in Road & C.O.P in "Gokulam Twin Bungalows", situated on the land bearing Revenue Survey No. 516, Block No. 864, Khata No. 1604, Total Adm 78206 Sq. Mtrs. Paiki 72106 Sq. Mtrs. (after road alignment adm. 6100 Sq.mtrs.) of Village : Mota, Taluka : Bardoli, Dist : Surat. Boundaries : East: Plot No. 95/C North : Plot No. 108/C, West: Adj. Society's Road, South : Plot No. 106/C.
 - (9) All That Piece And Parcel Of The Immovable Property Bearing Plot No 108/C, adm 131.68 SQ. Mtrs Together with undivided share adm 98.02 Sq.mtrs in Road & C.O.P in "Gokulam Twin Bungalows", situated on the land bearing Revenue Survey No. 516, Block No. 864, Khata No. 1604, Total Adm 78206 Sq. Mtrs. Paiki 72106 Sq. Mtrs. (after road alignment adm. 6100 Sq.mtrs.) of Village : Mota, Taluka : Bardoli, Dist : Surat. Boundaries : East: Plot No. 94/C North: Plot No. 109/C, West: Adj. Society's Road, South : Plot No. 107/C.
 - (10) All That Piece And Parcel Of The Immovable Property Bearing Plot No 118/C, adm 131.68 SQ. Mtrs Together with undivided share adm 98.02 Sq.mtrs in Road & C.O.P in "Gokulam Twin Bungalows", situated on the land bearing Revenue Survey No. 516, Block No. 864, Khata No. 1604, Total Adm 78206 Sq. Mtrs. Paiki 72106 Sq. Mtrs. (after road alignment adm. 6100 Sq.mtrs.) of Village : Mota, Taluka : Bardoli, Dist : Surat. Boundaries : East: Adj. Society's Road, North: Plot No. 117/C, West: Plot No. 128/C, South : Plot No. 119/C. Authorised Officer, Indian Bank, Salabatpura (E-Alb- Nanpura), Surat. Date: 09/11/2022

ATUL AUTO LIMITED
Reg. Office : Survey No. 86, Plot No. 1 to 4, 8-B, National Highway, Near Microwave Tower, Shapar (Veraval), Dist. Rajkot, 360 024
CIN L54100GJ1986PLC016999 | Website: www.atulauto.co.in | E-Mail: info@atulauto.co.in

Extract of Unaudited Standalone and Consolidated Financial Results for the Quarter and Half Year ended on September 30, 2022
(Rs. in lacs except per share data)

Sr. No.	Particulars	STANDALONE		CONSOLIDATED		
		Quarter Ended		Quarter Ended		Half Year ended
		30.09.2022 (Unaudited)	30.09.2021 (Unaudited)	30.09.2022 (Unaudited)	30.09.2021 (Unaudited)	
1	Total income from Operation (Net)	11,361	8,201	21,039	12,305	22,974
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extra ordinary Items)	57	(624)	(450)	9	(409)
3	Net Profit/(Loss) for the period before Tax (after Exceptional and/or Extra ordinary Items)	57	(624)	(450)	9	(409)
4	Net Profit/(Loss) for the period after Tax (after Exceptional and/or Extra ordinary Items)	37	(450)	(387)	(12)	(377)
5	Total Comprehensive Income for the period [Comprising Profit/(loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	28	(440)	(393)	(18)	(380)
6	Paid up Equity Share Capital	1,097	1,097	1,097	1,097	1,097
7	Earning Per Share (Basic and Diluted but not annualised) (Face value of Rs. 5/-)	0.17	(2.05)	(1.76)	(0.01)	(1.91)

Note : The above is an extract of the detailed format of Quarterly/Half Yearly Financial Results (Standalone and Consolidated) filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of financial results for the said Quarter and Half Year end are available on Stock Exchanges Websites: www.bseindia.com and www.nseindia.com. The same is also available on the website of the Company: www.atulauto.co.in

For and on behalf of Board of Directors of Atul Auto Limited
Jayantibhai J Chandra
Chairman & Managing Director
(DIN : 00057722)

Date : November 12, 2022
Place : Shapar (Dist. Rajkot)



The Indian Express.
For the Indian Intelligent.

I look at every side before taking a side.

Inform your opinion with insightful observations.

The Indian Express
— JOURNALISM OF COURAGE —

indianexpress.com

Ahmedabad

